

૧. પોતાના વ્યવસ્થાતંત્ર, કાર્યો અને ફરજોની વિગતો કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કુ.પુ., વધઈ (ડાંગ)

પરિચય

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર એ ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી તરફથી ગ્રાય ૧૦૦ % ગ્રાન્ટથી ચાલતી "દ્રાન્સફર ઓફ ટેકનોલોજી" માટેની વિસ્તરણ શિક્ષણ યોજના છે. ભારત સરકારે દેશના તમામ રાજ્યોના પ્રત્યેક જિલ્લામાં એક કૃષિ વિજ્ઞાન કેન્દ્રની સ્થાપના કરવાનું નક્કી કરેલ છે, તે મુજબ હાલ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓમાં એક-એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મંજૂર કરવામાં આવેલ છે. કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કાર્યક્ષેત્ર જે તે જિલ્લો હોય છે. કેન્દ્ર ડેફણ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હાથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગામોના જૂથ નક્કી કરીને ખેડૂતોને કૃષિ, બાગાયત, પાક સંરક્ષણ, પશુપાલન, મરધાઉંછેર, મત્સ્યપાલન, ગૃહવિજ્ઞાન વિગેરેની નવીન ટેકનોલોજીથી વાકેફ કરવા માટે કેન્દ્ર બહાર તથા કેન્દ્ર પર એક/ત્રણ દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે.

૧	સ્થાપનાનું વર્ષ	:	૧. કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કુ.પુ., વધઈ (ડાંગ)	૧૯૮૪
૨	યોજનાનો પ્રકાર	:	ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી (ભારત સરકાર)ની ૧૦૦ % ગ્રાન્ટથી ચાલતી "દ્રાન્સફર ઓફ ટેકનોલોજી" માટેની વિસ્તરણ શિક્ષણ યોજના છે.	
૩	હેતુઓ/ઉદ્દેશો (Mandates)	:	<p>૧. ખેડૂતો અને ગ્રામીણ યુવાનો માટે "કાર્ય દ્વારા શિક્ષણ" પર ભાર મુકીને કૃષિ અને સંલગ્ન વિષયો અંગે ટૂંકાં તેમજ લાંબાગાળાના વ્યવસાયિક તાલીમવર્ગો યોજીને સ્વરોજગારી વધારવાનો પ્રયત્ન કરવો.</p> <p>૨. નવીન કૃષિ તજ્જશ્તાઓ અંગે ખેડૂતોના પ્રતિભાવો જાણવા માટે ખેડૂતોના ખેતરો ઉપર વિવિધ પાકોના પ્રથમ હરોળના નિર્દર્શનો (Front line demonstrations) યોજવા.</p> <p>૩. સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવવા સારુ નવી બહાર પાડવામાં આવતી કૃષિ તજ્જશ્તાઓની જુદી જુદી કૃષિ-આબોહવાકીય પરિસ્થિતિમાં યોગ્યતા અને અનુકૂળતા ચકસવા માટે તથા ખેડૂતોને તે પ્રત્યક્ષ બતાવવા માટે ખેડૂતોના ખેતરો પર ક્ષેત્રિય-અભ્યતરા (On-farm trials) નું આયોજન કરવું.</p> <p>૪. કૃષિ અને સંલગ્ન વિષયોના સંશોધનો સંબંધી અધ્યતન માહિતી અંગે જે તે કાર્યક્ષેત્ર વિસ્તારના વિસ્તરણ કાર્યકરો/અધિકારીઓને જાણકારી આપીને નવીન તજ્જશ્તા અંગેના જ્ઞાનમાં વધારો કરવા માટે નિયમિત રીતે તાલીમ કાર્યક્રમો યોજવા.</p> <p>૫. જિલ્લાનું કૃષિ સંલગ્ન જ્ઞાન કેન્દ્ર (Knowledge Centre) તરીકે વિકસાવવું.</p>	
૪	કામગીરી	:	<p>કૃષિ વિજ્ઞાન કેન્દ્રનું કાર્યક્ષેત્ર જે તે જિલ્લો હોય છે. કેન્દ્ર ડેફણ ચાલતી પ્રવૃત્તિઓ ઘનિષ્ઠતાથી હાથ ધરી શકાય તે માટે જે તે જિલ્લાના ગામોના જૂથ નક્કી કરીને ખેડૂતોને કૃષિ, પશુપાલન, મરધાઉંછેર, મત્સ્યપાલન, ગૃહવિજ્ઞાન વિગેરેની નવીન ટેકનોલોજીથી વાકેફ કરવા માટે કેન્દ્ર બહાર તથા કેન્દ્ર પર એક દિવસીય તાલીમ વર્ગોનું આયોજન કરવામાં આવે છે.</p> <p>કૃષિ તાંત્રિકીનો અસરકારક પ્રચાર અને પ્રસાર કરવા તથા કાર્યક્ષેત્ર ડેફણ ખેડૂતો સાથે સતત સંપર્ક જાળવી રાખવા માટે કેન્દ્ર દ્વારા ખેડૂતદિન, ખેડૂતશિબિર, ફીલ્ડટ્રીપ, પદ્ધતિ નિર્દર્શનો, કૃષિપ્રદર્શન, કૃષિમેળો, ફિલ્મશો વિગેરે વિસ્તરણ પ્રવૃત્તિઓનું સમયાંતરે આયોજન કરવામાં આવે છે.</p> <p>ખેડૂતોના ખેતરે અગ્રીમ હરોળ નિર્દર્શનો ગોઠવી નવી તાંત્રીકતાઓ ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડવામાં આવે છે.</p> <p>સંલગ્ન વિભાગોનાં તાંત્રીક મહેકમને આધુનીક સંશોધનથી માહિતગાર કરવા તેઓને માટે ખાસ રીફરેશર તાલીમો આપવામાં આવે છે.</p> <p>કૃષિ સંલગ્ન વ્યવસાયને લગતી વ્યવસાયિક તાલીમો આપવામાં આવે છે.</p>	

૨. અધિકારીશ્રીઓ અને કર્મચારીઓની સત્તાઓ અને ફરજો

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વધઈ, જિ. ડાંગ હેઠળ ફરજ બજાવતા તાંત્રિક અધિકારીશ્રી/કર્મચારીઓ માટે કામગીરીની વહેચણી.

(૧) ડૉ. જી. ભી. ડોબરીયા, ઈ/ચા. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા

૧	હેડ ઓફ યુનિટ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, તથા હિસાબી વહીવટી કામગીરીની તમામ દેખરેખ તથા તાંત્રિક માર્ગદર્શન અને નિયંત્રણ.
૨	યુનિવર્સિટી કક્ષાની તથા મા.સરકારશ્રીની વખતો વખત ની બેઠકોમાં હાજરી આપવી.
૩	શિક્ષણ અને વિસ્તરણની કેન્દ્ર ખાતેની યોજનાઓનું આયોજન અને અમલની કામગીરી.
૪	યુનિ. અધિકારી તરીકે બધી યોજના (આયોજીત, બીનાયાયોજીત, અન્ય) ની જવાબદારી નિભાવણી.
૫	કેન્દ્ર ખાતેની બધી વિસ્તરણ યોજનાનું સંચાલન કરી કેન્દ્રને આદિવાસી બિસુખ બનાવવું.
૬	વૈજ્ઞાનિક સલાહકાર સમિતિની કામગીરીનું આયોજન અને અમલ

(૨) ડૉ. જી. ભી. ડોબરીયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)

૧	વિસ્તરણ શિક્ષણ વિષયક તાલીમનું આયોજન, તાલીમપત્રક અને મુલ્યાંકન કરવું, વિષયને લગતો જેતે સમયગાળાનો અહેવાલ તૈયાર કરવો. નવા ગામો પસંદ કરી પી.આર.એ. સદર્ભની કામગીરી
૨	દરેક વિષયોને લગતું સાહિત્ય પ્રસિદ્ધ કરવા માટેનું આયોજન અને અમલ
૩	વિસ્તરણ તાલીમ કાર્યક્રમ અંગે પત્ર વ્યવહાર
૪	કેન્દ્રની વિવિધ પ્રવૃત્તિઓ માટે લાભાર્થીઓ પસંદ કરવા દરેક વિષયના વિષય નિષ્ણાતોને મદદ કરવી.
૫	બધા વિષયોની વિસ્તરણ શિક્ષણ પ્રવૃત્તિઓનું સંકલન તથા આયોજન કરવું.
૬	ગોનલ કોઓર્ડિનેટર, મા.કુલપતિશ્રી તથા વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રી સાથે પત્રવ્યવહાર તથા રીપોરીટની કામગીરી
૭	એન્યુરલ એક્શન પ્લાન અને પ્રોથ્રેસ રીપોર્ટ બધા ટેબલની મદદથી તૈયાર કરવો.
૮	દરેક વિષયની પ્રેસનોટ એક્ઝન કરી પ્રસિદ્ધ માટે મોકલવી.
૯	વિષયને લગતી ખરીદીની દરખાસ્ત, ચાંટની મર્યાદામાં રહી સમયસર રજૂ કરવી.
૧૦	વિષયને લગતી કેસ સ્ટડી તથા ઈમ્પેક્ટ સ્ટડી તૈયાર કરવી.
૧૧	એગ્રોસ્કો તથા ઝર્ક મિટીગમાં નકદી થયેલ કામગીરીનો સમયસર અમલ કરવો
૧૨	વૈજ્ઞાનિક સલાહકાર સમિતી બાબતના આયોજન માટે પત્રવ્યવહાર, નોંધ તૈયાર કરી તથા મીનીટ્સ એપ્રુવલ કરાવવી.
૧૩	કૃષિ વિજ્ઞાન કેન્દ્ર માસિક, નિમાસિક, વાર્ષિક અહેવાલ, ZREAC Report, વૈજ્ઞાનિક સલાહકાર સમિતી (SAC), NAU Spectrum તૈયાર કરવા તથા સમયાંતરે સંબંધીત મોકલવાની કામગીરી.
૧૪	આકાશવાણી, દુરદર્શન, પ્રાઇવેટ ચેનલો, કૃષિ વિષય લેખો વગેરે સંબંધીત પત્રવ્યવહા અને ફાઈલ નિભાવવની કામગીરી.
૧૫	સેમિનાર/વર્કશોપ/પરિસંવાદ/કોન્ફરન્સ/વ્યાખ્યાન/તાંત્રિક ગૃહ મિટિંગ, ખાસ દિવસની ઉજવણી, ખેડૂત શિબિરો વિગેરેનું સંકલન, અમલ અને પત્રવ્યવહા
૧૬	વિસ્તરણ શિક્ષણ પરિષદ તથા નિયામક મંડળની બેઠક માટે જરૂરી તાંત્રિક માહિતી અને મુદ્દાનોંધ તૈયારી કરવી.
૧૭	કચેરીમાં તાંત્રિક માહિતી અને ખેડૂત ઉપયોગી સાહિત્યની ડિસ્પ્લે ગોઠવવી.
૧૮	સફળ વાર્તા/કેસ સ્ટડી તૈયાર કરી યોગ્ય જગ્યા અને સમયે તેની લેખિત તથા મૌખિક રજૂઆત કરવી.
૧૯	શ્રેષ્ઠ કેવીકે એવોઈ, ITK એવોઈ, સરદાર પટેલ એવોઈ, અસ્થી એવોઈ, એવોઈ ખેડૂતો તથા પ્રગતીશિલ ખેડૂતો એવોઈ સંબંધીત કામગીરી સમયાંતરે સંબંધીત કચેરીને મોકલવાની કામગીરી.
૨૦	વિસ્તરણ શિક્ષણ સંબંધી નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૨૧	કૃષિ વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃત્તિઓનું સમયાંતરે Impact Assessment કરવું.
૨૨	પોતાના વિષયને લગતી ખરીદીની સંપૂર્ણ કામગીરી.
૨૩	હેડ ઓફિસ/યુનિટ હેડ વખતો વખત મૌખિક / લેખિત કામગીરીની સોંપણી.

(૩) ડૉ. પી.પી. જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)

૧	સર્વ વિજ્ઞાન (એગ્રોનોમી) વિષયક તાલીમનું આયોજન અને અમલ કરવો તથા તાલીમ પત્રક અને મુલ્યાંકન તેમજ તાલીમવર્ગની સંપૂર્ણ વિગત આપતો અહેવાલ બનાવી ટેબલ કે-૧ ને આપવો.
૨	કેવીકે શાર્મ(રાજેન્ધ્રપુર) ના શાર્મ મેનેજરને માર્ગદર્શન પુરુ પાડવાની સંપૂર્ણ કામગીરી તથા રીવોલ્વીંગ ફંડને ચલાવવાની કામગીરી.
૩	જમીન ચકાસણી પ્રયોગશાળાની કામગીરી તથા સેમ્પલ કલેક્શન, ચકાસણી રીપોર્ટ તૈયાર કરવા.
૪	પાક ઉત્પાદનને લગતા નિર્દર્શનો માટે ખેડૂત પસંદ કરવા અને સમયસર નિર્દર્શનો લેવાય તેનું આયોજન કરી અમલ.

	કરવો. નિર્દર્શનો માટે જરૂરી ખરીદી કરવાનું આયોજન કરવું તથા નિર્દર્શનના જરૂરી ડેટા કલેશન કરવા.
૫	સેટ TOT 1,2,3,4 નું રીપોર્ટીંગ સમય મર્યાદા થાય માટે નિર્દર્શનોના ડેટા મેળવવા અને રીપોર્ટીંગ કરવું.
૬	વિષય પ્રમાણે વાર્ષિક બજેટ મુજબ ગ્રાન્ટની મર્યાદામાં રહીને ખર્ચનું સમયસર આયોજન અને અમલ કરવો.
૭	વિષયને લગતી ખરીદીની કામગીરી
૮	નિર્દર્શન યુનિટ તેમજ વ્યવસાયિક ધોરણો પાક, બીજું ઉત્પાદન, નિર્દર્શનો જેવા કે વર્માંકિંપોસ્ટ, ક્રોપ કાફેટેરીયા, પાક નિર્દર્શનો, વોટર હારવેસ્ટીંગ વગેરે બનાવવામાં અને જાળવણીમાં માર્ગદર્શન આપવું.
૯	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી / તથા વિષયને લગતી ઈમ્પેક્ટ સ્ટડી તૈયાર કરવી રીપોર્ટીંગ કરવી
૧૦	કેવીકે ફાર્મના વિકાસ માટે ફાળવેલ ગ્રાન્ટનો સંપૂર્ણ ઉપયોગ થાય તે માટે સમયસર જરૂરી દરખાસ્ત અને કામગીરી કરવી.
૧૧	વિષયને લગતું ઓન ફાર્મ તથા ઓફ ફાર્મ રીસર્ચને લગતું આયોજન અને અમલ
૧૨	ગામડામાં જઈને પ્લાન્ટ / સોઝિલ / વોટર સેમ્પલ કલેક્શન કરાવી તેનું પૃથ્વીકરણ થાય તેવું આયોજન કરવું.
૧૩	ZREAC અને AGRESCO માં એગ્રોનોમિ વિષય પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મના અભતરા (OFT) નો તાંત્રિક કાય કમ મંજૂર કરવા તથા પરિણામોના આંકડાની રજુઆત કરવી.
૧૪	સ્થાનિક ભાષામાં લેખો, પુસ્તકો, ફોલ્ડરો તૈયાર કરવા.
૧૫	પાક ઉત્પાદન સંલગ્ન તમામ પ્રવૃત્તિઓનું ડોક્યુમેન્ટેશન અને રીપોર્ટીંગ કરવું
૧૬	વિષયને આધારીત કેસ સ્ટડી / ઈમ્પેક્ટ સ્ટડી/ સફળ વાર્તા તૈયાર કરી વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) ને આપવી.
૧૭	કેવીકેની પાક યોજનાની મંજૂરીની કામગીરી.
૧૮	રિવોલ્વીંગ ફંડમા આવક વધે તેવી પ્રવૃત્તીઓનું આયોજન, સંકલન અને સંબંધીત કામગીરી.
૧૯	વિષયને લગતાં AGRESCO અને BOSS ના રીપોર્ટીંગની તમામ કામગીરી.
૨૦	"મેરા ગાંંબ મેરા ગૌરવના" નોડલ અધિકારી તરીકે અન્ય વૈજ્ઞાનિકના સંકલનમાં કામગીરી કરી વખતો વખત રીપોર્ટીંગ કરવું.
૨૧	હેડ ઓફિસ/યુનિટ હેડ વખતો વખત મૌખિક / લેખિત કામગીરીની સોધે તે કામગીરી.

(૪) શ્રી અચ. એ. પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત)

૧	બાગાયત વિષયક તાલીમનું આયોજન અને અમલ કરવો તથા તાલીમ પત્રક અને મુલ્યાંકન અને તાલીમ વર્ગનો સંપૂર્ણ વિગત આપતો અહેવાલ તૈયાર કરી ટેબલ કે-૧ ને પહોંચાડવો.
૨	બાગાયત વિષયને લગતાં પાકોના નિર્દર્શન ગોઠવવા તથા તેનું આયોજન (ફળ અને શાકભાજી, કંદ મુળ પાકો/ શ્રીન હાઉસ વગેરે) અને જરૂરી ખરીદી કરવાનું સમયસર આયોજન કરવું
૩	ફાર્મ ઉપર ફળપાકો / શાકભાજીની નરસરી બનાવવી નેટ હાઉસ તથા કોમર્શિયલ ધોરણે વેચાણ કરવું
૪	વિષય પ્રમાણે વાર્ષિક બજેટ મુજબ ખર્ચનું આયોજન અને અમલ
૫	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૬	વિષયને લગતી જરૂરી પ્રાણીરી તથા તેને લગતી જરૂરી પ્રપોઝલ તૈયાર કરી પત્રવ્યવહાર કરવો.
૭	વિષયને લગતી ઓન ફાર્મ રીસર્ચની સંપૂર્ણ કામગીરી તથા તેને લગતી જરૂરી પ્રપોઝલ તૈયાર કરી પત્રવ્યવહાર કરવો.
૮	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી અને ઈમ્પેક્ટ સ્ટડી તૈયાર કરવી.
૯	ZREAC અને AGRESCO બાગાયત વિષય અંગોના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મના અભતરા (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરવા તથા પરિણામોના આંકડાની રજુઆત કરવી.
૧૦	વિષયને આધારીત કેસ સ્ટડી/ઇમ્પેક્ટ સ્ટડી/સફળ વાર્તાની માહિત તૈયાર કરીને વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ) ને આપવી.
૧૧	કેવીકે ફાર્મનો બાગાયતી પાકોના અભતરાં, નિર્દર્શન પ્લોટ તથા પાક કૌતુકાલય તૈયાર કરી ફાર્મ મેનેજરને માર્ગદર્શન પૂરું પાડવું
૧૨	સ્થાનિક ભાષામાં લેખો, પુસ્તકો, ફોલ્ડરો તૈયાર કરવા.
૧૩	વિષયને લગતાં AGRESCO અને BOSS ના રીપોર્ટીંગની તમામ કામગીરી.
૧૪	બાગાયતી વિષયક નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૧૫	રિવોલ્વીંગ ફંડમા આવક વધે તેવી પ્રવૃત્તીઓનું આયોજન, સંકલન અને સંબંધીત કામગીરી.

(૫) ડા. એસ. એ. પટેલ, વૈજ્ઞાનિક (પશુપાલન)

૧	પશુપાલન વિષયક તાલીમનું આયોજન અને અમલ કરવો તથા તાલીમ પત્રક અને મુલ્યાંકન કરવું તેમજ તાલીમ વર્ગને લગતી સંપૂર્ણ વિગત આપતો અહેવાલ તૈયાર કરી ટેબલ કે-૧ ને સુપ્રત કરવો.
૨	પશુ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવું
૩	વિષયને લગતાં સાહિત્ય પ્રકાશનની કામગીરી

૪	પશુપાલન વિષયક નિર્દર્શન યુનિટો તૈયાર કરવા તેમજ નિર્દર્શન યુનિટની કામગીરી અને વ્યાવસાયિક ધોરણો ચલાવવું.
૫	વિષય પ્રમાણે વાર્ષિક બજેટ મુજબ ગ્રાંટની મર્યાદામાં રહી ખર્ચનું આયોજન અને અમલ કરી વિષયને સબળ બનાવવો તથા ખરીદીનું અણાઉથી આયોજન કરી ખરીદી કરવી.
૬	વિષયના ઓન ફાર્મ રીસર્ચની કામગીરી, તેને લગતી જરૂરી પ્રપોઝલ તૈયાર કરી તથા તેને લગતા પત્રવ્યવહાર કરવો.
૭	વિષયને લગતી સફળ વાર્તા/ કેસ સ્ટડી અને ઈમ્પેક્ટ સ્ટડી બનાવવી.
૮	આર.ટી.આઈ. પત્રવ્યવહાર અને ફાઇલો નિભાવવાની કામગીરી.
૯	પશુવિજ્ઞાન સંદર્ભે અંગે હરોળના નિર્દર્શન ગોઠવવા તથા ઓન ફાર્મ ટેસ્ટિંગનું આયોજન કરવું.
૧૦	ZREAC અને AGRESCO પશુપાલન વિષય અંગેના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મના અખતરા (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરવા તથા પરિણામોના આંકડાની રજુઆત કરવી.
૧૧	વિસ્તરણ પ્રવૃત્તિઓ જેવી કે પશુપાલન શિબિર, પશુ આરોગ્ય કેમ્પ, માહિતી પુસ્તિકા-ફોલ્ડર, પુસ્તક વિતરણ વગેરેનું આયોજન કરવું.
૧૨	જિલ્લાની સરકારી અને બિનસરકારી સંસ્થાઓ જેમ કે જિલ્લા પંચાયત, પશુ દવાખાના, ખેડૂત તાલીમ કેન્દ્ર વગેરે સાથે સંકલન કરી પશુ વિજ્ઞાન સંલગ્ન વિસ્તરણ પ્રવૃત્તિઓ કરવી.
૧૩	સ્થાનિક ભાષામાં લેખો, પુસ્તકો, ફોલ્ડરો તૈયાર કરવા.
૧૪	પશુ વિજ્ઞાન સંલગ્ન તમામ પ્રવૃત્તિઓનું ડોક્યુમેન્ટેશન અને રીપોર્ટીંગની કામગીરી.
૧૫	વિષયને આધારીત કેસ સ્ટડી/ઇમ્પેક્ટ સ્ટડી/સફળ વાર્તાની માહિત તૈયાર કરીને વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)ને આપવી.
૧૬	પશુપાલન અંગેની તમામ ખરીદી અને પત્રવ્યવહાર તથા ફાઇલની જાળવણી.
૧૭	વર્મિકમ્પોસ્ટ તથા વિષયને લગતી ડેમોનસ્ટ્રેશન યુનિટની સંભાળવાની કામગીરી.
૧૮	હેડ ઓફિસ/યુનિટ હેડ વખતો વખત મૌખિક / લેખિત કામગીરીની સોધે તે કામગીરી.
(૫)	શ્રી બી.એ.મ. વહુનિયા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)
૧	પાક સંરક્ષણ વિષયક તાલીમનું આયોજન અને અમલ કરવો તથા તાલીમ પત્રક અને મુલ્યાંકન કરવું તેમજ વિષયને લગતા તાલીમ વર્ગની સંપૂર્ણ વિગત આપતો અહેવાલ તૈયાર કરી ટેબલ કે-૧ ને સુપ્રત કરવો.
૨	વિષય પ્રમાણે વાર્ષિક બજેટ ગ્રાંટની મર્યાદામાં રહીને ખર્ચનું આયોજન અને અમલ કરી વિષયને સબળ બનાવવો નિર્દર્શનો માટે જરૂરી ખરીદીનું આયોજન કરી ખરીદી કરવું.
૩	વિષયને લગતા સાહિત્ય પ્રકાશનની કામગીરી
૪	વિષયને લગતી ખરીદીની કાર્યવાહી કરવી
૫	વિષયને લગતી રીસર્ચ (ઓએફટી)ની કામગીરી
૬	પ્લાન્ટ હેલ્પ ડાઈનોસ્ટીક માટે તથા વિષયને અનુરૂપ લેબોરેટરી સ્થાપવી અને નિભાવવી.
૭	પાક સંરક્ષણ સાધનોની ખરીદી, રીપોર્ટીંગની કામગીરી.
૮	એપીકલ્યર અને મશરૂમ યુનિટનું આયોજન અને નિભાવવું
૯	વિષયને લગતી સફળ વાર્તા / કેસ સ્ટડી અને ઈમ્પેક્ટ સ્ટડી તૈયાર કરવી.
૧૦	જિલ્લાના દાટક ગામોમાં પાક સંરક્ષણ વિષય આધારીત પ્રસ્ત એરીયા નક્કી કરી કામગીરીનું આયોજન.
૧૧	કેવીકે ફાર્મનો અખતરાં, નિર્દર્શન પ્લોટ તથા પાક કૌતુકાલયમા રોગ દેખરેખ રાખી તેને નિયંત્રણ જરૂરી પગલાં લેવાની કામગીરી.
૧૨	પાક સંરક્ષણ અંગેના અંગ્રેઝ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મના અખતરા (OFT) સંબંધીત કામગીરી.
૧૩	અન્ય વિભાગના ફાર્મ પરના અખતરાં (FLD) અને અંગ્રેઝ હરોળના નિર્દર્શનો (OFT) માં રોગ જીવાત અંગે દેખરેખ રાખી તેને નિયંત્રણ માં લેવાના જરૂરી પગલાં લેવાની કામગીરી.
૧૪	વિષયને લગતાં AGRESCO અને BOSS નાં રીપોર્ટીંગની તમામ કામગીરી.
૧૫	સ્થાનિક ભાષામાં લેખો, પુસ્તકો, ફોલ્ડરો તૈયાર કરવા.
૧૬	વિષયને લગતી કેસ સ્ટડી / ઇમ્પેક્ટ સ્ટડી/ સફળ વાર્તાને તૈયાર કરી વિસ્તરણ શિક્ષણને આપવી.
૧૭	પ્લાન્ટ હેલ્પ કિલનીક માટે તથા વિષયને અનુરૂપ લેબોરેટરી સ્થાપવી અને નિભાવવી.
૧૮	રોગ અને જીવાત અંગેના પ્રશ્નો ફિલ્ડ વિઝિટ કરી ખેડૂતોને માર્ગદર્શન આપવું.
૧૯	ખેડૂતો દ્વારા લાવવામાં આવતા રોગોનું અને જીવાતોનું સેમ્પલ ચેક કરી યોગ્ય માહિતી આપવી.
૨૦	જિલ્લાની સરકારી અને બિનસરકારી સંરક્ષણ વિષય પાક સંરક્ષણ અંગેના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મના અખતરા (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરવા તથા પરિણામોના આંકડાની રજુઆત કરવી.
૨૧	ZREAC અને AGRESCO પાક સંરક્ષણ વિષય પાક સંરક્ષણ વિષય પાક સંરક્ષણ અંગેના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મના અખતરા (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરવા તથા પરિણામોના આંકડાની રજુઆત કરવી.
૨૨	પાક સંરક્ષણ વિષયને લગતી નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.

૨૭	રિવોલ્વીંગ ફંડમા આવક વધે તેવી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને સંબંધીત કામગીરી.
૨૮	આપના વિભાગને લગતા ડેમોનસ્ટ્રેશન યુનિટની જાણકારીની સંપૂર્ણ જવાબદારી.
૨૯	હેડ ઓફિસ/યુનિટ હેડ વખતો વખત મૌખિક / લેખિત કામગીરીની સોધે તે કામગીરી.
(૭) વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન) (ખાલી જગ્યા)	
૧	ગૃહ વિજ્ઞાન વિષયક તાલીમનું આયોજન, તાલીમ પત્રક અને મૂલ્યાંકન કરવું તેમજ તાલીમને લગતી સંપૂર્ણ વિગત આપતો અહેવાલ બનાવી ટેબલ કે-૧ ને સુપ્રત કરવો.
૨	વિષયને લગતું સાહિત્ય પ્રકાશન કરવું
૩	વિષય પ્રમાણે બજેટ મુજબ ખર્ચનું આયોજન કરવું
૪	વિષયને લગતી સફળ વાર્તા/કેસ સ્ટડી અને ઈમ્પેક્ટ સ્ટડી તૈયાર કરવી
૫	મહિલા મંડળો (એસ.એચ.જી) બનાવવા અને તેઓને માર્ગદર્શન આપવું
૬	કિયન ગાર્ડન / ન્યુટ્રીશન ગાર્ડના નિર્દર્શનો ગોઠવવા તથા આવું એક યુનિટ કે.વી.કે. ખાતે નિભાવવું.
૭	માસિક જરૂરીયાત મુજબ એબસ્ટ્રેક ઉપાડવું અને તેના હિસાબ જાણવણી કરી સબમિટ કરવા.
૮	ખેડૂતો મહિલાઓ માટે જરૂરીયાતલક્ષી ડેન્ઝિય, ક્ષેત્રિય અને રોજગારલક્ષી તાલીમ કાર્યક્રમ કરવા. તે સંબંધીત ફાઈલ/રેકર્ડની જાણવણી.
૯	આંગણવાડી વર્કર/ આરોગ્ય વર્કર/ ફિલ વર્કર મહિલાઓ માટે ઈન્સર્વિસની તાલીમી કાર્યક્રમ કરવા.
૧૦	ગૃહ વિજ્ઞાન અતંગત અગ્રિમ હરોળના નિર્દર્શન ગોઠવવા તથા ઓન ફાર્મ ટેસ્ટિંગનું આયોજન કરવું.
૧૧	કેવીકે ફાર્મનો બાગાયતી પાકોના અખતરાં, નિર્દર્શન પ્લોટ તથા પાક કૌતુકાલય તૈયાર કરવાની કામગીરી.
૧૨	વિસ્તરણ પ્રવૃત્તિઓ જેવી કે મહિલા શિબિર, મહિલા મિટીગ, સ્વ સહાય જૂથ, મહિલા સંલગ્ન દિવસની ઉજવણી વગેરેનું આપોજન.
૧૩	જિલ્લાની સરકારી અને બિનસરકારી સંસ્થાઓ જેમ કે ICDS, NGOs, રાષ્ટ્રીય બેંકો, ખેડૂત તાલીમ કેન્દ્ર વગેરે સાથે સંકલન કરી ગૃહ વિજ્ઞાન સંલગ્ન વિસ્તરણ પ્રવૃત્તિઓ કરવી.
૧૪	સ્થાનિક ભાષામાં લેખો, પુસ્તકો, ફોલરો તૈયાર કરવા.
૧૫	ગૃહ વિજ્ઞાન સંલગ્ન તમામ પ્રવૃત્તિઓનું ડોક્યુમેન્ટેશન અને રીપોર્ટિંગની કામગીરી.
૧૬	વિષયને આધારીત કેસ સ્ટડી/ઇમ્પેટ સ્ટડી/સફળ વાર્તાની માહિત તૈયાર કરીને વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)ને આપવી.
૧૭	વૈજ્ઞાનિક બાગાયત સાથે રહી રહ્યું પ્રમાણે કિયન ગાર્ડનીગ સંબંધી કામગીરી.
૧૮	ZREAC અને AGRESCO ગૃહ વિજ્ઞાનના પ્રથમ હરોળના નિર્દર્શનો (FLD) અને ફાર્મના અખતરા (OFT) નો તાંત્રિક કાર્યક્રમ મંજૂર કરવા તથા પરિણામોના આંકડાંની રજૂઆત કરવી.
૧૯	ગૃહ વિજ્ઞાન વિષયને લગતી નવી યોજનાઓની દરખાસ્તની કામગીરી.
૨૦	રિવોલ્વીંગ ફંડમા આવક વધે તેવી પ્રવૃત્તિઓનું આયોજન, સંકલન અને સંબંધીત કામગીરી.
૨૧	હેડ ઓફિસ/યુનિટ હેડ વખતો વખત મૌખિક / લેખિત કામગીરીની સોધે તે કામગીરી.
૨૨	વિષયને લગતી ખરીદીની કામગીરી કરવી.
૨૩	લાઈફ્ઓરીની સંપૂર્ણ કામગીરી.
(૮) શ્રી આર.એસ. પટેલ, તાલીમ મદદનીશ (ફાર્મ મેનેજર)	
૧	કેવીકે કયેરીના કન્યુયુમેબલ સ્ટોર શાખાની જાણવણી અને સંપૂર્ણ કામગીરી.
૨	તાલીમમાં આવતાં તાલીમાર્થીઓની (ઓન ક્રેમ્પસ તથા ઓફ ક્રેમ્પસ)વ્યવસ્થા કરવી તથા તેને લગતા ખર્ચની કામગીરી.
૩	કયેરીનાં / એફ.એલ.ડી. નાં કામકાજ માટે જરૂરી ડિઝલ / ઓઈલની સમયસરની ખરીદીની કામગીરી.
૪	કેવીકેના બધા વાહનોની મરામતની/જાણવણીની કામગીરી, લોગબુકની કામગીરી. (ટેબલ.કે-૪ નું માર્ગદર્શન લેવું.)
૫	કેન્દ્રની/ફાર્મની મુલાકાતે આવતાં ઉચ્ચ અવિકારીશીઓ/ વી.આઈ.પી. ઓની સરભર કરવી.
૬	કેવીકે ફાર્મની સંપૂર્ણ કામગીરીનું આયોજન કરી અમલ કરવો તથા રિવોલ્વીંગ ફંડની કામગીરી કરવી. (ટેબલ.કે-૨ નું માર્ગદર્શન લેવું.)
૭	ફાર્મના ટ્રોકટર રીપેરીંગ લોકબુક, હિસ્ટ્રીસીટ તથા જરૂરી ફાઈલ નિભાવવી.
૮	રિવોલ્વીંગ યોજના (બ.સ.૨૦૭૬/૧૪/કે.આર.એસ.) ની કામગીરી માટે થનાર ખર્ચનું એબસ્ટ્રેક મુકવું તથા નાણાંકીય હિસાબ રાખવો અને સમયસર હિસાબ રજૂ કરવો.
૯	કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ઈન્સ્ટ્રુક્શનલ ફાર્મની ટેખરેખ, પાક આયોજન તથા મેનેજમેન્ટે લગતી તમામ જવાબદારી.
૧૦	લબ્ધ મસ્ટર, દેનિક મજૂરી પત્રકો નિભાવવા તથા મજૂરોની કામગીરીની વહેંઘણી.
૧૧	નેટ હાઉસ તથા વર્મિકમ્પોસ્ટ લગતી કામગીરી.

૧૨	ડાંગર બીયારણથી લઈને વેચાણ સુધીની કામગીરી તથા ગોડાઉનની દેખરેખ અને જાળવણી.
૧૩	RKVY હોસ્ટેલ અને કિશાનઘરની સફાઈ તથા જાળવણી માટે જે તે સંબંધિત અધિકારીના માર્ગદર્શન હેઠળ દેખરેખ રાખવી.
૧૪	અનુપ્રમાણે પાક યોજના બનાવવાની સંપૂર્ણ જવાબદારી.
૧૫	કૃષિ વિજ્ઞાન કેન્દ્રના ફાર્મ મેનેજર તરીકેની સંપૂર્ણ જવાબદારી નિભાવવી.
૧૬	ફાર્મ/કચેરીની તમામ ખરીદી.
૧૭	મંજુરી રજીસ્ટરની કામગીરી.
૧૮	ફાર્મનો સંપૂર્ણ સ્ટોર ચાર્જ.
૧૯	મજુર મસ્ટર તથા એનિક હાજરી ભરવી.
૨૦	ફાર્મને લગતા તમામ ફાઈલ અને પત્રવ્યવહાર કામગીરી.
૨૧	સ્ટોરને લગતા તમામ રેકૉર્ડ નિભાવવા તથા જાળવણી કરવી. તેમજ ડેડસ્ટોકો ચાર્જ સંભાળી તેને સંલગ્ન તમામ રેકૉર્ડ્સ જાળવવા.
૨૨	મંજુરી, કન્ઝ્યુમર/સ્ટોર રોજમેળ તમામ રેકૉર્ડ નિભાવવા તથા જાળવણી કરવી.
૨૩	હેડ ઓફિસ/યુનિટ હેડ વખતો વખત મૌખિક / લેખિત કામગીરીની સોપે તે કામગીરી.
(૮)	શ્રી કે.વી. પટેલ, તાલીમ મદદનીશ (ભેતીવાડી અધિકારી)
૧	ટેબલ કે-૨ સાથે સંલગ્ન રહી સઘણી પ્રકારની કામગીરી કરવી.
૨	કિસાનઘરને લગતી તેમજ તાલીમાર્થીઓના રહેઠાણની તથા ભોજનને લગતી કામગીરી ટેબલ કે-૭ સાથે મળીને કરવી. કિશાન ઘર સાફ-સફાઈની દેખરેખ અને સંબંધિતને સુચન આપી રાખી કામ કરાવવું. (કે.૪ નું માર્ગદર્શન લેવું)
૩	કેવીકેનાં ફાર્મ અને ગામોનાં નિદર્શન યુનિટોની દેખરેખ વિષય નિષ્ણાંતોની સુચના મુજબ રાખવી.
૪	દ્રશ્ય શ્રાવ સાધનોની જાળવણી અને તેનો ઉપયોગ (ટેબલ.કે-૬ નું માર્ગદર્શન લેવું)
૫	કેવીકેનાં ફાર્મનાં શ્રમયોગીઓની કામગીરી ઉપર દેખરેખ
૬	ફાર્મની કામગીરીમાં ટેબલ કે-૨ નાં તાંત્રિક માર્ગદર્શન હેઠળની કામગીરી.
૭	કેવીકે ફાર્મ પરનાં બધા જ ક્ષેત્ર પાકોની સમયસરની જમીન તૈયારી, વાવણી, નિંદામજા, કાપણી, ઝુડણી અને સફાઈની કામગીરી તથા ઉત્પાદનને સ્ટોરમાં જમા કરાવવાની કામગીરી, બીજ ઉત્પાદન કાર્યક્રમની સમયસરનાં સઘણા ખેતી કાર્ય કરવાની જવાબદારી. કે.વી.કે ખાતેના નિદર્શનો યુનિટ/અભતરાના બોર્ડ બનાવવા તથા વ્યવસ્થિત લગાડાવવા.
૮	શ્રમયોગીઓનાં લેબર સીટ તથા મસ્ટર રોલ તૈયાર કરવાં તથા તેની જાળવણી કરવી તથા દેનિક ધોરણે ફાર્મ મેનેજર અને અધિકારીની સહી કરાવવી.
૯	ફાર્મને લગતા રજીસ્ટરો જેવા કે સ્ટોર રોજમેળ, ખાતાવહી, ફાર્મ હસ્ટ્રીસીટ, જાડ રજીસ્ટર, બાંધકામ રજીસ્ટર વગેરે તથા ફાર્મ ઉત્પાદન અને વેચાણ રજીસ્ટર, નિભાવવા તથા સમયસર નાણાં કચેરીમાં જમા કરાવવા.
૧૦	કે.વી.કે ફાર્મ ખાતેના નિદર્શનો યુનિટોમાં જે તે વિષય નિષ્ણાંતના માર્ગદર્શન હેઠળ કામગીરી કરાવવી.
૧૧	સ્ટોરને લગતા તમામ રજીસ્ટરો નિભાવવાની કામગીરી (તમામ બજેટ સદર).
૧૨	કચેરીની તાંત્રિક ખરીદી/રીપેરીંગની કાર્યવાહી કરવાની કામગીરી.
૧૩	બોલેરો જીપની લોગબુક તથા લિસ્ટ્રીશીટ લખવાની કામગીરી.
૧૪	કચેરીના તમામ વાહનોના વિમા અંગેની કામગીરી.
૧૫	કચેરી, કિસાનઘર અને RKVY હોસ્ટેલમાં પાણી અને વિજણીની સગવડતા માટે વ્યવસ્થાની કામગીરી.
૧૬	વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન) ની કામગીરીમાં મદદ કરવી.
૧૭	હેડ ઓફિસ/યુનિટ હેડ વખતો વખત મૌખિક / લેખિત કામગીરીની સોપે તે કામગીરી.
(૧૦)	શ્રી ટી.આર. આહિર, તાલીમ મદદનીશ (કોમ્પ્યુટર પ્રોગ્રામર) (શ્રી આહિરનો અત્રેના કેન્દ્ર ખાતે ફક્ત પગારભથ્થાંનો બ્યાર પડે છે પરંતુ તેમની કામગીરી અસ્પી બાગાયત -૧-વનીપ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., નવસારી કેન્દ્ર ખાતે છે.)
૧	કચેરીનું તાંત્રિક, વહીવટી અને એકાઉન્ટને લગતું કોમ્પ્યુટર ટાઈપીગની કામગીરી
૨	કચેરી / લેબોરેટરી ખાતેના કોમ્પ્યુટર અને સંલગ્ન ઉપકરણોની જાળવણી સમયાંતરે સર્વિસીંગ, રીપેરીંગ વગેરેની કામગીરી.
૩	તાલીમ દરમાન એલસીડી પ્રોજેક્ટર ઓપરેટ કરવું અને તેની જાળવણી.
૪	તાલીમમાં આવતાં ખેડૂત મિત્રો/તાલીમાર્થીઓનું રજીસ્ટ્રેશનની કામગીરી તથા પાણી નાસ્તાની વ્યવસ્થા તથા બેટક વ્યવસ્થાની કામગીરી.
૫	કેન્દ્ર/ફાર્મની મુલાકાતે આવતાં વી.આઈ.પી. તથા ખેડૂતોનું વિગતવાર માહિતી રજીસ્ટર નિભાવવું તથા નોંધણી કરવી.

૬	કચેરી ખાતે ઈ-ક્રેડિટીવીટી, ઈન્ટરનેટ વ્યવસ્થા અને દરરોજના કેવીકે ઈ-મેઈલ ચકાસણી કરી કચેરી વડાને મુકવા.
૭	કચેરીમાં ઈન્વર્ડ-આઉટવર્ડ તેમજ ટપાલ સંબંધી કામગીરીનો રેકૉર્ડ રાખવો.
૮	કોમ્પ્યુટર લગતી તમામ કામગીરી અને જાળવણી.
૯	ઓનલાઈન પગાર બનાવવાની કામગીરી.
૧૦	વેબસાઈટ અપડેટ કરવી.
૧૧	ઓનલાઈન MES તથા PFMS ની એન્ટ્રી કરવી.
૧૨	હેડ ઓફિસ/યુનિટ હેડ વખતો વખત મૌખિક/લેખિત કામગીરીની સોંપે તે કામગીરી.

(૧૧) શ્રી જી.આર. પઢીયાર, જી. કલાર્ક

(શ્રી પઢીયારને અઠવાડીયાના ફક્ત ૨ (૨) દિવસ અત્રેના કેન્દ્ર ખાતેની કામગીરી કરવા જણાવવામાં આવેલ છે અને તેમનો પગારભથ્યાંનો ખર્ચ હવકા ધાન્ય સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., વધઈ ખાતે છે તથા સદર જગ્યાનો પગારભથ્યાંનો ખર્ચ શ્રી ડી.એન. પટેલ, હેડ કલાર્કનો પડે છે પરંતુ તેમની કામગીરી ફળ સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., ગણદેવી કેન્દ્ર ખાતે છે.)

૧	કેન્દ્ર પરના કેશીયર તરીકેની સંઘળી કામગીરી.
૨	કેશને લગતા કેશબુક સહિતના રજીસ્ટરો વાવયરોની જાળવણી.
૩	એન.પી.ડી.સી.બીલો અંગેની સંઘળી કામગીરી.
૪	ઓડિટ અંગે હિસાબી રેકર્ડ રજૂ કરવા બી.ર ની કામગીરીમાં મદદ કરવી.
૫	કેન્દ્રના ખર્ચ-આવક અંગેના હિસાબો તેયાર કરવા મેળવણું કરવું રજીસ્ટરો નિભાવવાની સંઘળી કામગીરી.
૬	કેન્દ્રના માસિક/ત્રિમાસિક ખર્ચ આવક પત્રકો, આઈ.સી.એ.આરને માંંયા મુજબ મોકલવા અને પાર્ટી પેમેન્ટ આવક જમા કરાવવાની સંઘળી કામગીરી.
૭	I. Tax/ P.Tax ના ચલણો તેયાર કરવા તથા પત્રવ્યવહાર અંગેની સંઘળી કામગીરી.
૮	કેન્દ્રના દરેક અધિકારી/ કર્મચારીઓની સેવાપથીની, રજા હિસાબ પુસ્તિકા, જામીનખત વગેરે દસ્તાવેજોની યોગ્ય જાળવણી તેને લગતા સંઘળી કામગીરી અને તેનો પત્રવ્યવહાર.
૯	કેન્દ્ર હેઠળના દરેક અધિકારી/ કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ નિયમોનુસાર મંજુર કરવા અંગેની કામગીરી તથા તેને લગતા જરૂરી રજીસ્ટરો નિભાવવા જાળવવા.
૧૦	કેન્દ્ર હેઠળના દરેક અધિકારી/ કર્મચારીઓની સેવાપોથી નિમણુંક / બદલી/ લાયકીઆડ-પગાર નક્કી કરવા વાર્ષિક ઈજાફાઓ મંજુર કરવા અંગેની સંઘળી કામગીરી તથા તેને લગતા જરૂરી રજીસ્ટરો નિભાવવાની કામગીરી
૧૧	કેન્દ્રના માસિક ત્રિમાસિક વહીવટી ચાર્જ પત્રકો તેયાર કરવા તેના ફેરફારની નોંધ વગેરે કરી ચાર્જ પત્રકો નિયમિત પણ મોકલવા તેમજ તે અંગેનો બધો પત્ર વ્યવહાર
૧૨	ખાસ પગાર મંજુર કરવા તેમજ તેને લગતા સંઘળો પત્ર વ્યવહાર
૧૩	વહીવટી બાબતોને લગતા સરકારી તેમજ યુનિ. ટ્રાવો/ પરિપત્રોની વિષયવાર સ્ટેન્ડીંગ ઓડિરોની એસસો ફાઈલ પરિપત્રોની ફાઈલ નિભાવવી.
૧૪	કેન્દ્ર પર નિવૃત્ત થનાર અધિકારી/ કર્મચારીઓના પેન્શન દરખાસ્ત સમયસર તેયાર કરવી તથા પત્ર વ્યવહાર
૧૫	નવી નિમણુંક પામતા કર્મચારીઓના જીથ વિમા (જી.એસ.એલ.આઈ) યોજનામાં દાખલ કરવા તેમજ કેટેગરી ચેઇન્જ લગતી માહિતી સાદર કરવી.
૧૬	કેન્દ્રને વહીવટી બાબતોને લગત એમ.એસ.સી/ પી.એચ.ડી તાલીમ અંગેની તેમજ અન્ય વહીવટી માહિતી માંંયા મુજબ તેયાર કરી મોકલવાની કામગીરી
૧૭	હેડ ઓફિસ/ યુનિટ હેડ વખતો વખત મૌખિક/ લેખિત કામગીરીની સોંપણી.
૧૮	(૧૨) સ્ટેનોગ્રાફર ગેડ-ડ (ખાલી જગ્યા)
૧	કેન્દ્ર પરના પગારબીલો/પુરવણી બીલો/ મુસાફરી ભથ્યાં/ પેશણી બીલો/ પે.ડી.સી.બીલો/ એ.બીલો/ પી.એફ. બીલો/ રીફડ બીલો તેમજ અન્ય તમામ બીલો તેયાર કરવા રજીસ્ટરો નિભાવવા તથા સંઘળો પત્રવ્યવહાર
૨	હિસાબને લગતી માહિતી મોકલવી. GSLI પેશણી અંગેના રજીસ્ટરો નિભાવવા, કેશબુક સરવાળા ખરાઈ કરવા.
૩	પી.એફ.પાસબુકો નિભાવણી અને સાચવણી મંજુર કરાવવા તેમજ સંઘળી કામગીરી.
૪	હિસાબી કામને લગતા ટ્રાવો/પરિપત્રોની SO File ની નિભાવણી.
૫	ખર્ચ/આવક/કન્ટીજન્સી ખર્ચ, રજીસ્ટરો નિભાવવા બી.૧ ટેબલને મદદ કરવી.
૬	બેંક કામગીરી માટે કેશીયર સાથે જવું અને મદદ કરવી.
૭	કેન્દ્રના આંતરિક ઓડિટ, લોકલફિઝ ઓડિટ, ભૌતિક ચકાસણી ઓડિટ પેરા અંગેની સંઘળી કામગીરી.
૮	I. TAX/P.TAX અંગેની સંઘળી કામગીરી.

૬	કેન્દ્રની દરેક યોજનાઓના બજેટ સમયસર તૈયાર કરવા, તે અંગેની ફાઈલ નિભાવવી દરેક યોજનાઓના ગ્રાન્ટ મંજુરીના હુકમોનીફાઈલ નિભાવવી, તેને લગતા પત્રવ્યવહાર જરૂરી રજીસ્ટરો નિભાવવા જાળવવા.
૧૦	કેન્દ્ર હેઠળની કલેક્ટરશ્રી, ડાંગ-આહવા ધ્વારા મળતી ગ્રાન્ટ અંગે જરૂરી બજેટ સમયસર રજુ કરવા તથા તે અંગેના સઘણ પ્રકારના પત્રવ્યવહારની કામગીરી
૧૧	કેન્દ્ર પાસે માંગવામાં આવતી સામાન્ય માહિતી તેમજ અન્ય માહિતીઓનું સંકલન કરવવાની તેમજ સમયસર મોકલવામાં આવે તે જોવું.
૧૨	કેન્દ્રની દરેક પ્રકારની સ્ટેશનરી આઈટમો તાંત્રિક રજીસ્ટરો ફોર્મ હિસાબી વહિવટી રજીસ્ટરો પત્રકો વગેરેના સંકલન કરી તેના ઈનડેન્ટ સમયસર તૈયાર કરવા તથા તે રજુ કરવા અને તે મુજબ મેળવવા અંગેની તમામ પ્રકારની કામગીરી, સ્ટેશનરીની જાળવણી અને ફાળવણી તથા તેના લગતા રજીસ્ટરોની નિભાવણી -જાળવણી કરવી.
૧૩	કેન્દ્રના સહી સિકકા રજીસ્ટરોની જાળવણી નિભાવણી તથા દરેક પ્રકારના હિસાબી / ટેકનીકલ રજીસ્ટરો કચેરીના સહી સિકકા જરૂરી પ્રમાણિત થયા બાદ ઉપયોગમાં લેવાય તે મુજબ ઈશ્યુ કરવાની કામગીરી.
૧૪	કેન્દ્ર હેઠળના રહેઠાણના મકાનની ફાળવણી તેને લગતા જરૂરી રજીસ્ટરો નિભાવણી તથા તે અંગેના પત્ર વ્યવહાર
૧૫	કેન્દ્રના વર્ગ-ઉ તથા વર્ગ-૪ ના કર્મચારીઓના ગણવેશ, બુટ, થંપલ, રેઇન કોટ, છત્રી, બોલપેન, મળવા પાત્ર હોય તે પૂરી પાડવા અંગેની કામગીરી તથા જરૂરી રજીસ્ટરો નિભાવવા તેમજ તે અંગે જરૂરીપત્રવ્યવહાર
૧	કેન્દ્ર પરના આઉટવર્ક/ઇનવર્ક રજીસ્ટરો નિભાવવા તથા ટપાલ જે તે શાખા ટેબલને પહોંચાડવાની કામગીરી.
૨	મજૂર મસ્ટરો ઈશ્યુ કરવા.
૩	પોસ્ટેજ સ્ટેમ્પના રજીસ્ટરો નિભાવવા
૪	પ્રવાસ ડાયરી અને પ્રવાસને લગતી સઘણી કામગીરી, રાજ્યની અંદર, રાજ્ય બહાર વિ. સેમીનાર, વર્કશોપ, એગ્રેસ્કો વિ. સર્વે પ્રવાસની કામગીરી.
૫	રહેઠાણના મકાનની ફાળવણી તથા તેને લગતા રજીસ્ટરો નિભાવવા, જાળવણી અને તેને લગતા પત્રવ્યવહારની સઘણી કામગીરી મકાન રીપેરીંગ માટેની સર્વે કામગીરી કરવી તથા સાયકલોસ્ટાઇલ અને ઝેરોક્ષ મશીન રીપેરીંગ અને તેને લગતી કામગીરી.
૬	કેવીકે હસ્તકની દરેક સ્કીમના ડેડસ્ટોક જાળવણી, નિભાવણી, રીપેરીંગ વગેરેને લગતી સઘણી કામગીરી
૭	લાઈટબીલો, ટેલીફોન બીલો, સીક્યુરીટી બીલ તેમજ અન્ય બીલો તૈયાર કરી હિસાબી શાખામાં મોકલવાની તથા તે અંગેની સઘણી કામગીરી અને તેને લગતો પત્રવ્યવહાર.
૮	કલેક્ટરશ્રી આહવા ડાંગ તેમજ જીલ્લાની કચેરીઓ તરફથી યોજનાની મિટીંગ / તાલીમ, વર્કશોપ વગેરેના પત્ર વ્યવહાર તેમજ ફાઈલની જાળવણી.

૩. ટેબરેખ અને જવાબદારીના માધ્યમ સહિત નિર્ણય લેવાની પ્રક્રિયામાં અનુસરવાની કાર્યરીતિ;

નિર્ણય લેવાની કાર્યરીતિ :

વહીવટી—વ—હિસાબી કર્મચારી / સાયન્ટીસ્ટ» સીનીયર સાયન્ટીસ્ટ એન્ડ હેડ» વિસ્તરણ શિક્ષણ નિયામકશી/ સંશોધન નિયામકશી / કુલસચિવશી » કુલપતિશી / ઝોનલ પ્રોજેક્ટ ડાયરેક્ટરશ્રી, પુને.

૪. પોતાના કાર્યો બજાવવા માટે નક્કી કરેલા ધોરણો

૧. ખેડૂતો અને ગ્રામીણ યુવાનો માટે "કાર્ય દ્વારા શિક્ષણ" પર ભાર મુક્કીને કૃષિ અને સંલગ્ન વિષયો અંગે ટૂકાં તેમજ લાંબાગાળાના વ્યાવસાયિક તાલીમવગ્નો યોજીને સ્વરોજગારી વધારવાનો પ્રયત્ન કરવો.
૨. નવીન કૃષિ તજ્જાતોઓ અંગે ખેડૂતોના પ્રતિભાવો જાણવા માટે ખેડૂતોના ખેતરો ઉપર વિવિધ પાકોના પ્રથમ હરોળના નિર્દર્શનો (Front line demonstrations) યોજવા.
૩. સ્થાનિક પરિસ્થિતિને અનુરૂપ ટકાઉ ખેતી પદ્ધતિઓ વિકસાવવા સારુ નવી બહાર પાડવામાં આવતી કૃષિ તજ્જાતાઓની જુદી જુદી કૃષિ—આબોહવાકીય પરિસ્થિતિમાં યોગ્યતા અને અનુકૂળતા ચક્કાસવા માટે તથા ખેડૂતોને તે પ્રત્યક્ષ બતાવવા માટે ખેડૂતોના ખેતરો પર ક્ષેત્રિય-અભતરા (On-farm trials) નું આયોજન કરવું.
૪. કૃષિ અને સંલગ્ન વિષયોના સંશોધનો સંબંધી અધ્યતન માહિતી અંગે જે તે કાર્યક્ષેત્ર વિસ્તારના વિસ્તરણ કાર્યક્રમ/અધિકારીઓને જાણકારી આપીને નવીન તજ્જાતા અંગેના શાન્નમાં વધારો કરવા માટે નિયમિત રીતે તાલીમ કાર્યક્રમો યોજવા.

૫. કાર્યો બજાવવા માટે પોતાની પાસેના અથવા નિયંત્રણ હેઠળના કે કર્મચારીઓ દ્વારા અનુસરવામાં આવતા નિયમો, વિનિયમો, સૂચનાઓ, નિયમ સંગ્રહો અને તે સંબંધી રેકર્ડ

કૃષિ યુનિવર્સિટીની સ્ટેચ્યુટરી જોગવાઈઓ મુજબ નિયમો, વિનિયમો અને સૂચનાઓને અનુસરવામાં આવે છે તેમજ માન. રાજ્ય સરકારશીના કૃષિ અને સહકાર વિભાગના આદેશો અનુસાર તથા કેન્દ્ર સરકારશીના આઈસીએઆરની માર્ગદર્શન હેઠળ કામગીરી કરવામાં આવે છે તથા હિસાબી કામગીરીનું લોકલ ફંડ ઓરીટરશી દ્વારા ઓરીટ કરાવવામાં આવે છે. તેમજ અત્રેની એકમ દ્વારા જરૂરી રજીસ્ટરો નિભાવવામાં આવે છે જેવા કે, ડેડસ્ટોક, સ્ટોર રોજમેળ, થીજવસ્તુ વપરાશ, મંજૂરી, લેબરસીટ, હાજરીપત્રક, રીપેરીગ, સાધનોની લોગબુક, વાહનની લોગબુક અને હીસ્ટ્રીસીટ, નમૂના રજીસ્ટર, પરચૂરણ રજા, ટપાલ આવક જાવક તથા હિસાબી રજીસ્ટરો જેવા કે કેસબુક, રસીદ બુક, માસિક ખર્ચ પત્રક રજીસ્ટર વિગેરે રેકર્ડની નિભાવણી કરવામાં આવે છે.

૬. પોતાની પાસે અથવા પોતાના નિયંત્રણ હેઠળ હોય તેવા દસ્તાવેજોની કક્ષા અને વર્ગીકરણનું પત્રક;

૧. ટેકનીકલ(તાંત્રીક) દસ્તાવેજો

	ટેબલ	ફાઈલનો વિષય
૧	કુ. ડૉ. બી. ડેબરીયા, (દિ/ચા. વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા)	૧. ફાર્મ જમીન ફાળવણીની ફાઈલ ૨. ઓફિસ મકાન બાબતની ફાઈલ ૩. કવાર્ટર બાબતના ઠરાવો—જાહેરનામુંની ફાઈલ ૪. કવાર્ટર એ, બી, સી—બાંધકામ ફાઈલ ૫. જનરલ પત્રોની ફાઈલ ૬. ટેકનીકલ જનરલ ફાઈલ ૭. આત્મા કન્વર્જન ફાઈલ ૮. આર.કે.વી.વાય. ફાઈલ ૯. કૃષિ મહોત્સવ ફાઈલ
૨	કુ-૧ ડૉ. બી. ડેબરીયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)	૧. ઝર્ક રીપોર્ટ ફાઈલ ૨. એંગ્યુઅલ ફાઈલ ૩. એન્યુઅલ રીપોર્ટ સંબંધીત ફાઈલ ૪. એશન પ્લાનની ફાઈલ ૫. સાહિત્ય પ્રકાશન તેમજ ચા—નાસ્તો, ભોજનને લગતી ફાઈલ ૬. વૈજ્ઞાનિક સલાહકાર સમિતી અંગેની ફાઈલ ૭. તાંત્રીક સપ્તાહ અંગેની ફાઈલ ૮. ઝેડ.પી.ડી., જોધપુર, આઈ.સી.આર.અને ઓન.ઓ.યુ. સાથેના પત્ર વ્યવહારની ફાઈલ ૯. વિસ્તરણ તાલીમ રજીસ્ટર
૩	કુ-૨ ડૉ. પી.પી. જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)	૧. ઓન કેમ્પસ ટ્રેનીંગ રજીસ્ટર ૨. ઓફ કેમ્પસ ટ્રેનીંગ રજીસ્ટર ૩. એફ.એલ.ડી. રજીસ્ટર ૪. જમીન ચકાસણી લેબના સાધનો રજીસ્ટર ૫. સીડ વિલેજ રજીસ્ટર ૬. માટી નમુના વિતરણ રજીસ્ટર ૭. ફાર્મ, જમીન અને ઝડની ફાઈલ ૮. આવક પત્રક ફાઈલ ૯. જાવક પત્રક ફાઈલ ૧૦. વિષયને સંબંધીત એફ.એલ.ડી/ ઓ.ઓફ.ટી/ તાલીમ અંગેના ખર્ચની ફાઈલ ૧૧. સીડ વિલેજ ફાઈલ

૪	કે-૩ શ્રી એચ.એ. પ્રજાપતિ, વૈજ્ઞાનિક (બાગાયત)	<ol style="list-style-type: none"> ૧. એફ.એલ.ડી. ખરીદી ફાઈલ ૨. ઓ.એફ.ટી. ખરીદી ફાઈલ ૩. ટ્રેનીંગ રજીસ્ટર ૪. આર.કે.વી.વાય. ફાઈલ (૨૦૧૨-૧૩, ૨૦૧૩-૧૪) ૫. વિષયને સંબંધીત એફ.એલ.ડી/ ઓ.એફ.ટી/ તાલીમ અંગેના ખર્ચની ફાઈલ ૬. નેટ હાઉસ સમારકામ ફાઈલ
૫	કે-૪ ડૉ. એસ.એ. પટેલ, વૈજ્ઞાનિક (પશુપાલન)	<ol style="list-style-type: none"> ૧. ફંટ લાઇન ડેમોન્સ્ટ્રેશન રજીસ્ટર ૨. ઓન ફાર્મ ટેસ્ટીંગ રજીસ્ટર ૩. પશુ સારવાર ક્રેમ્પ રજીસ્ટર ૪. વધઈ ખાતે પશુ પોલિકલીનીક ફાઈલ ૫. ડાંગ વિકાસ સમિતી ફાઈલ ૬. આર.ટી.આઈ. ફાઈલ ૭. કૃષિ કોલેજમાં શિક્ષણની ફાઈલ ૮. કૃષિ પોલિટેકનીકમાં શિક્ષણની ફાઈલ ૯. વાહન રેકોર્ડની ફાઈલ ૧૦. તાલીમ રજીસ્ટર પશુપાલન ૧૧. કૃષિ મહોત્સવ ફાઈલ ૧૨. આર.કે.વી.વાય. ફાર્મર્સ ફોસ્ટેલ અંગેની ફાઈલ ૧૩. એગ્રેસ્કો ફાઈલ ૧૪. ટેબલને લગતા પત્ર વ્યવહારની ફાઈલ ૧૫. ડૉ. સી.ટી.ખસ્તીયાની બદલી થતાં તેઓ ધ્વારા તા.૦૪/૦૪/૨૦૧૧ના રોજ આપેલ ચાર્જ લીસ્ટ મુજબ તમામ ફાઈલો, રજીસ્ટરો તથા ફોલ્ડરો ૧૬. ખરીદી ફાઈલ
૬	કે-૫ શ્રી બી.એમ. વહુનિયા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)	<ol style="list-style-type: none"> ૧. પ્લાન્ટ હેલ્પ કલીનીકની સ્થાપના અને ખરીદી બાબતની ફાઈલ ૨. વર્ષ ૨૦૧૨ થી આજદીન સુધી કચેરી બીલીંગ અને કવાર્ટરને લગતો પત્ર વ્યવહાર (બીલીંગ રજીસ્ટર તેમજ પાવતી સામેલ નથી.) ૩. કચેરી બીલીંગ તેમજ કવાર્ટરના રીપેરીંગ બાબતનો પત્ર વ્યવહારની ફાઈલ ૪. આર.કે.વી.વાય. મશરૂમ પ્રોજેક્ટની ફાઈલ ૫. તાલીમ રજીસ્ટર ૬. ફંટ લાઇન ડેમોન્સ્ટ્રેશન રજીસ્ટર ૭. ઓન ફાર્મ ટેસ્ટીંગ રજીસ્ટર ૮. ટેબલને લગતા પત્ર વ્યવહારની ફાઈલ ૯. શ્રી ડૉ.આર.પટેલની ૦૬/૦૪/૨૦૧૧ના રોજ બદલી થતાં તેમના ધ્વારા શ્રી ડૉ.સી.એસ.દેસાઈને આપવામાં આવેલ પદ ફાઈલો ૧૦. વિષયને સંબંધીત એફ.એલ.ડી/ ઓ.એફ.ટી. અંગેના ખર્ચની ફાઈલ
૭	કે-૬ -:: ખાલી જગ્યા ::- વૈજ્ઞાનિક (ગૃહવિજ્ઞાન)	<ol style="list-style-type: none"> ૧. એફ.એલ.ડી., ઓ.એફ.ટી. અંતર્ગત ઇનપૂટ્સ સામગ્રીની પહોંચ ફાઈલ ૨. લાઈબ્રેરી રજીસ્ટર ૩. સામગ્રીક મેગેઝીન નોંધણી રજીસ્ટર ૪. લાઈબ્રેરી બૂક ઇસ્યુ રજીસ્ટર ૫. લાઈબ્રેરી પત્ર વ્યવહાર ફાઈલ ૬. પરચૂરણ પત્ર વ્યવહાર ફાઈલ ૭. વિષયને સંબંધીત એફ.એલ.ડી/ ઓ.એફ.ટી. અંગેના ખર્ચની ફાઈલ
૮	કે-૭ શ્રી આર.એસ. પટેલ તાલીમ મદદનીશ (ફાર્મ મેનેજર)	<ol style="list-style-type: none"> ૧. ફાર્મના પત્ર વ્યવહારની ફાઈલ ૨. પરચૂરણ ખરીદીની ફાઈલ ૩. સ્ટોર રોજમેળ બ.સ.૨૭૦૪-૬, ૨૦૭૬-૧૪ ૪. ખાતાવહી રજીસ્ટર બ.સ.૨૭૦૪-૬, ૨૦૭૬-૧૪

		<p>પ. ચીજ વસ્તુ વપરાશ રજીસ્ટર બ.સ.૨૭૦૪-૬, ૨૦૭૬-૧૪</p> <p>૬. સ્થાનિક મંજૂરી રજીસ્ટર બ.સ.૨૭૦૪-૬, ૨૦૭૬-૧૪</p> <p>૭. ખાણ ખ-નીજ રજીસ્ટર બ.સ.૨૭૦૪-૬, ૨૦૭૬-૧૪</p> <p>૮. લોગબુક જીપ, મોબાઇલવાન બ.સ.૨૭૦૪-૬</p> <p>૯. હિસ્ટ્રી સીટ જીપ, મોબાઇલવાન બ.સ.૨૭૦૪-૬</p>
૮	-:: ખાલી જગ્યા ::-	<p>૧. ઇનવર્ડ, આઉટવર્ડ સંબંધીત કામગીરી</p> <p>૨. ટપાલ, ટીકિટનો હિસાબ રાખવો.</p> <p>૩. પ્રોગ્રામ આસીસ્ટન્ટ કોમ્પ્યુટર સંબંધી જવાબદારી</p>
૧૦	કે-૮ શ્રી કે.વી. પટેલ, તાલીમ મદદનીશ (ખેતીવાડી અધિકારી)	<p>૧. દૈનિક મંજૂરી પત્રક</p> <p>૨. પાક ઉત્પાદન રજીસ્ટર</p> <p>૩. ખેત પેદારા સૌપણી પત્રક</p> <p>૪. મજૂર મસ્ટર</p> <p>૫. તારીખ પત્રક</p> <p>૬. ડેડસ્ટોક રજીસ્ટર</p>

૨. વહીવટી દસ્તાવેજો

	ટેબલ	ફાઈલનો વિષય
૧.	બી-૨ શ્રી જે.આર. પઢીયાર, જુ. કલાર્ક	<p>૧. કેન્દ્રના દરેક અધિકારી/ કર્મચારીઓની સેવાપોથી/ રજા હિસાબ પુસ્તીકા/ જામીન ખત વગેરે દસ્તાવેજોની યોગ્ય જાળવણી તેને લગતા સઘણા રજીસ્ટરો</p> <p>૨. કેન્દ્ર હેઠળના દરેક અધિકારી/ કર્મચારીઓની તમામ પ્રકારની રજાઓ નિયમોનુસાર મંજૂર કરવા તેને લગતા જરૂરી રજીસ્ટરો</p> <p>૩. કેન્દ્રના માસિક ત્રિમાસિક પત્રકો અંગેની ફાઈલ.</p> <p>૪. જનરલ પત્ર વ્યવહારની ફાઈલ.</p> <p>૫. ઓડિટ અંગેના રેકર્ડની ફાઈલ.</p> <p>૬. છરાવો પરિપત્રની ફાઈલ.</p> <p>૭. કેન્દ્ર પર નિવૃત થનાર અધિકારી/ કર્મચારીઓની પેન્શન દરખાસ્તની ફાઈલ.</p> <p>૮. કર્મચારીના જુથ વિમા અંગેની ફાઈલ.</p> <p>૯. કેન્દ્ર પરના આઉટવર્ડ/ ઇનવર્ડ રજીસ્ટરો</p> <p>૧૦. કર્મચારીઓની પ્રવાસ ડાયરીની ફાઈલ</p> <p>૧૧. રહેઠાણના મકાનોની ફાળવણી અંગેની ફાઈલ.</p> <p>૧૨. બજેટ ફાઈલ</p> <p>૧૩. ગ્રાન્ટના હુકમોની ફાઈલ</p>

૩. હિસાબી દસ્તાવેજો

	ટેબલ	ફાઈલનો વિષય
૧.	બી-૧ શ્રી જે.આર. પઢીયાર, જુ. કલાર્ક	<p>૧. કેશબુકની ફાઈલ</p> <p>૨. વાઉચરોની ફાઈલ.</p> <p>૩. એન.પી.ડી.સી. બીલો, પે.ડી.સી. બીલોની ફાઈલ.</p> <p>૪. કેન્દ્રના ખર્ચ- આવક અંગેના રજીસ્ટરો</p> <p>૫. ઇન્કમટેક્ષ, પ્રો.ટેક્ષ, ચલણો વગેરેની ફાઈલ.</p> <p>૬. જે તે નાણાંકીય વર્ષમાં ખર્ચ- આવકની ફાઈલ.</p>

૭. તેની નીતિ ઘડતરના અથવા તેના અમલીકરણ સંબંધમાં જનતાના સત્યો સાથે વિચારવિનિમય માટે અથવા તેમના દ્વારા રજુઆત માટેની વિધમાન કોઈ વ્યવસ્થાની વિગતો:-

PRA સર્વે દ્વારા ગામના લોકોને સહભાગી બનાવી શ્રસ્ત એરીયા નક્કી કરી તે પ્રમાણે ખેતી વિષયક તાલીમો અને વિસ્તરણ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે.

કૃષિ વિજ્ઞાન કેન્દ્રની કામગીરી અમલીકરણ અંગે વૈજ્ઞાનિક સલાહકાર સમિતિ અને વિસ્તરણ શિક્ષણ નિયામકશી દ્વારા આપવામાં આવતું માર્ગદર્શન મુજબ અમલીકરણ કરવામાં આવે છે.

૮. તેના ભાગ તરીકે અથવા તેની સલાહના હેતુ માટે બે અથવા તેથી વધુ વ્યક્તિઓના બનેલા બોર્ડ, કાઉન્સિલ, સમિતી અને બીજા મંડળોની બેઠકો લોકો માટે ખુલ્લી છે કે કેમ ? અથવા તેવી બેઠકોની કાર્યનોંધો લોકોને મળવાપાત્ર છે કે કેમ ?

તેના ભાગ તરીકે બોર્ડ, કાઉન્સિલ, સમિતી અને બીજા મંડળોની બેઠકો બનાવવામાં આવેલ નથી. પરંતુ વૈજ્ઞાનિક સલાહકાર સમિતી બનાવવામાં આવેલ છે. જેમાં ફક્ત સત્યશ્રીઓ જ ભાગ લઈ શકતા હોય સામાન્ય નાગરીક માટે તેમાં પ્રવેશ નથી.

વૈજ્ઞાનિક સલાહકાર સમિતિના સત્યો

અ.નં	સત્યશ્રીનું નામ અને હોદ્દો	પદ
૧.	ડૉ. જે.પી.પટેલ, માન. કુલપતિશ્રી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી	અધ્યક્ષ
૨.	નિયામકશી, અટારી, આઈ.સી.એ.આર., પુના.	સત્ય
૩.	ડૉ. સી.કે. ટીબડીયા, ઈ./ચા.વિસ્તરણ શિક્ષણ નિયામકશી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી.	"
૪.	ડૉ. ટી.આર. અહેવાલવત, ઈ./ચા.સંશોધન નિયામકશી, નવસારી કૃષિ યુનિવર્સિટી, નવસારી.	"
૫.	ડૉ. એચ.ઈ.પાટીલ, સહ સંશોધન વૈજ્ઞાનિકશી, હલકા ધાન્ય સંશોધન કેન્દ્ર, ન.કૃ.યુ., વધઈ.	"
૬.	ડૉ. એ. પી. પટેલ (સહપ્રાધ્યાપક) સસ્યવિજ્ઞાન, કૃષિ મહાવિદ્યાલય, ન. કૃ. યુ., વધઈ, જિ.ડાંગ.	"
૭.	ડૉ. એસ. એન. સરવેયા, (સહપ્રાધ્યાપક અને વડા) વેજીટેબલ સાયન્સ, આર્સ્પી બાગાયત-વ-વનીય મહાવિદ્યાલય, ન. કૃ. યુ., નવસારી	"
૮.	પ્રોજેક્ટ નિયામકશી, આત્મા, આહવા, જિ.ડાંગ.	"
૯.	ટેચ્યુટી જનરલ મેનેજર, નાયાર્ડ, આહવા, જિ.ડાંગ.	"
૧૦.	જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા પંચાયત ભવન, આહવા, જિ.ડાંગ.	"
૧૧.	મદદનીશ બાગાયત નિયામકશી, આહવા, જિ.ડાંગ.	"
૧૨.	એરીયા મેનેજર, આગામાન, આહવા, જિ.ડાંગ.	"
૧૩.	જિલ્લા પશુપાલન અધિકારીશી, જિલ્લા પંચાયત ભવન, આહવા, જિ.ડાંગ.	"
૧૪.	શ્રી. બેનુભાઈ મહાદુખાઈ ગાયકવાડ (પ્રગતિશીલ ખેડૂત) મુ.નડગખાડી, તા.આહવા, જી.ડાંગ.	"
૧૫.	શ્રીમતી. બાલીબેન લાલજીભાઈ ગામીત, (પ્રગતિશીલ ખેડૂત મહિલા) મુ.લોસકાતરી, તા.આહવા, જી.ડાંગ.	"
૧૬.	શ્રી કાશીરામભાઈ ઝી. બિરારી (કૃષિઉદ્યોગ સાહસિક), મુ. જામલાપાડા, તા. આહવા, જી.ડાંગ.	"
૧૭.	શ્રીમતી. ભારતીબેન ઝીતુભાઈ પટેલ (પ્રમુખ, મહિલા સ્વ સહાય જૂથ), મુ. વધઈ, જી.ડાંગ.	"
૧૮.	ડૉ. ઝી. ઝી. ચૌહાણ, વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડાશ્રી, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.કૃ.યુ., વધઈ (ડાંગ)	સત્ય સચિવશ્રી

આમંત્રિત સત્યો:

અનુષ્ઠાનિક સત્યો	આમંત્રિત
૧૯. ડૉ. ઝે.જે.પસ્તાગીયા, ઈ./ચા. આચાર્યશ્રી, કૃષિ મહાવિદ્યાલય, ન.કૃ.યુ., વધઈ (ડાંગ).	
૨૦. ડૉ. મહાવીર ચૌધરી, આચાર્યશ્રી, કૃષિ પોલીટેકનિક, ન.કૃ.યુ., વધઈ (ડાંગ).	"
૨૧. ચેરમેનશ્રી, ખાપરી સહકારી મંડળી, વધઈ, જિ.ડાંગ.	"

૯. તેના અધિકારીઓ અને કર્મચારીઓની માહિતી; સ્ટાફની પરિસ્થિતિ
(માર્ચ-૨૦૨૨ અંતિત)

અ.નં.	કર્મચારીનું નામ	હોદ્દો
૧	ખાલી જગ્યા	વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા
૨	ડૉ. જે.બી. ડોબરીયા	વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)
૩	શ્રી એચ.એ. પ્રજાપતિ	વૈજ્ઞાનિક (ભાગાયત)
૪	શ્રી બી.એમ. વહુનિયા	વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)
૫	ખાલી જગ્યા	વૈજ્ઞાનિક (ગૃહ વિજ્ઞાન)
૬	ડૉ. એસ.એ. પટેલ	વૈજ્ઞાનિક (પશુપાલન)
૭	ડૉ. પી.પી. જાવિયા	વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)
૮	શ્રી આર.એસ. પટેલ	તાલીમ મદદનીશ (ફાર્મ મેનેજર)
૯	શ્રી કે.વી. પટેલ	તાલીમ મદદનીશ (ખેતીવાડી અધિકારી)
૧૦	શ્રી ટી.આર. આહિર	તાલીમ મદદનીશ (કોમ્પ્યુટર પ્રોગ્રામર)
૧૧	શ્રી ડી.એન. પટેલ	હેડ કલાર્ક
૧૨	ખાલી જગ્યા	સ્ટેનોગ્રાફર ગ્રેડ-૩
૧૩	ખાલી જગ્યા	ધ્રૂવવર કમ મીડિનીક (જીપ)
૧૪	શ્રી ડી.એન. પરમાર	પટાવાળા કમ (મેસેન્જર)
૧૫	ખાલી જગ્યા	પટાવાળા (ફાર્મ એટેન્ડન્ટ)

૧૦. તેના વિનિયમોમાં જોગવાઈ કર્યા પ્રમાણે વળતરની પદ્ધતિ સહિત તેના દરેક અધિકારીઓ
અને કર્મચારીઓને મળતા માસિક વળતરની વિગતો;
(માર્ચ-૨૦૨૨ અંતિત)

અ.નં	કર્મચારીનું નામ	પગાર ધોરણ	પગાર	ગ્રેડ પે.	કુલ રૂ.
૧	૨	૩	૪	૫	૬
૧	ડૉ. જે.બી.ડોબરીયા, વૈજ્ઞાનિક (વિસ્તરણ શિક્ષણ)	57700-182400-0-0	68,800/-	-	91,295/-
૨	શ્રી એચ.એ. પ્રજાપતિ, વૈજ્ઞાનિક (ભાગાયત)	57700-182400-0-0	66,800/-	-	86,154/-
૩	શ્રી બી.એમ. વહુનિયા, વૈજ્ઞાનિક (પાક સંરક્ષણ)	57700-182400-0-0	61,200/-	-	81,278/-
૪	ડૉ. પી.પી. જાવિયા, વૈજ્ઞાનિક (પાક ઉત્પાદન)	57700-182400-0-0	61,200/-	-	81,278/-
૫	ડૉ. એસ.એ. પટેલ, વૈજ્ઞાનિક (પશુપાલન)	57700-182400-0-0	61,200/-	-	88,190/-
૬	શ્રી આર.એસ. પટેલ, ફાર્મ મેનેજર	39900-126600-0-0	41,100/-	-	54,785/-
૭	શ્રી ટી.આર. આહિર, ખેતીવાડી અધિકારી	39900-126600-0-0	47,600/-	-	62,942/-
૮	શ્રી કે.વી. પટેલ, ખેતીવાડી અધિકારી	39900-126600-0-0	41,100/-	-	54,785/-
૯	શ્રી ડી.એન. પટેલ, હેડ કલાર્ક	35400-112400-0-0	46,100/-	-	61,176/-
૧૦	શ્રી ડી.એન. પરમાર, પટાવાળા	14800-47100-0-0	19,300/-	-	26,028/-

૧૧. તમામ યોજનાઓ, સૂચિત ખર્ચ અને કરેલ વહેચણી પરના અહેવાલોની વિગતો દર્શાવતી તથા તે દરેક એજન્સીને ફાળવેલા નાણાંકીય સંશાધનોની વિગતો;

કચેરીનું નામ :— વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા, કે.વિ.કે., નાંદું, વધર્દ (ડાંગ)

સાર્ને. ૨૦૨૧–૨૨ (માર્ચ–૨૦૨૨ અંતિત)

અ.નં.	યોજનાનું નામ	બજેટહેડ	ફાળવેલ ગ્રાન્ટ	થયેલ ખર્ચ
૧	૨	૩	૪	૫
1	Krishi Vigyan Kendra, N.A.U., Waghai (Dangs)	2704/06/NF	1,24,41,000/-	1,16,43,127/-
2	KVK-Waghai (7 th Pay Arrears Fund)	3100-05	53,52,000/-	19,14,819/-
3	Atmosphere & Climate Research – Modeling Observing System and Service (ACROSS)	2121-02	2,32,878/-	9,83,065/-
4	Strengthening of testing of University technology through Farmers field adaptive trial Phase - II	12306-0D	2,00,000/-	2,00,000/-
5	TSP Megaseed Project	2068-0B	50,000/-	50,000/-
6	Cluster Frontline Demonstrations on Pulses funded under NFSM during 2019-20	2105-0B	1,80,000/-	-
7	Paramgrant Krishi Vikas Yojana (PKVY)	2125-03	53,866/-	53,866/-
8	Microbialbased Agricultural Waste Management Using Vermicomposting Under (SAP)	2132-04	45,500/-	45,500/-
9	Capacity Building of Farmers through Training Programmes on Profitable Dairy Farming and Livestock Management	18229-02	2,00,000/-	2,00,000/-
10	Farmers outreach Programme on Natural Farming as a part of Pre-Vibrant Gujarat Summit	2142-04	14,105/-	14,105/-

૧૨. ફાળવેલી રકમો અને તેવા કાર્યક્રમોના લાભાર્થીઓની વિગતો સહિત આર્થિક સહાય કાર્યક્રમોની અમલ બાજુંવણીની રીત;

જિલ્લામાંથી દર ત્રણ વર્ષે ૧૦ ગામો પસંદ કરી તેમાં સઘન કામગીરી કરવામાં આવે છે. તેમજ જિલ્લાના આન્ય ગામોમાં પણ જરૂરીયાત મુજબ કામગીરી કરવામાં આવે છે.

કેન્દ્ર દ્વારા આપવામાં થતી સામગ્રી તેમજ કામગીરી માટે ગામ લેવલે ખેડૂત મિટીગ કરી લાભાર્થીઓની પસંદગી કરવામાં આવે છે.

આર્થિક સહાય આપવામાં આવતી નથી. નિર્દર્શન માટે જરૂરી કીટ પુરી પાડવામાં આવે છે.

૧૩. છૂટછાટો, પરવાનગીઓ અથવા અધિકૃતિઓ મેળવનારાની વિગતો;

— લાગુ પડતું નથી. —

૧૪. ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં ઉપલબ્ધ અથવા ધરાવેલી માહિતીને લગતી વિગતો;

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર દ્વારા કરવામાં આવેલ દરેક કામગીરીની માહિતી યુનિવર્સિટીની વેબસાઈટ (www.nau.in > kvk waghai) (<http://www.nau.in/home.php?unit=kvkw>) પર ઉપલબ્ધ રહે છે.

૧૫. જાહેર ઉપયોગ માટે નિભાવવામાં આવતા હોય તેવા ગ્રંથાલય અથવા તેવા વાંચનાયના કામકાજના કલાકો સહિતની માહિતી તથા તે મેળવવા માટે નાગરિકોને ઉપલબ્ધ સુવિધાઓની વિગતો;

કેન્દ્ર દ્વારા બહાર પડેલ કૃષિ સાહિત્ય ખેડૂતોમાં વિનામૂલ્યે વિસ્તરણ કરવામાં આવે છે જે કચેરી સમય દરમ્યાન મળી શકે છે.

૧૬. જાહેર માહિતી અધિકારીઓના નામો, હોદ્દાઓ અને બીજી વિગતો;

ડૉ. જે.બી. ડોબરીયા
જાહેર માહિતી અધિકારી અને
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા,
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર,
નવસારી કૃષિ યુનિવર્સિટી, વધુરી (ડાંગ)
ઓફિસ ફોન નં.
(૦૨૬૩૧) ૨૮૬ ૬૪૫

૧૭. ઠરાવવામાં આવે તેવી બીજી માહિતી; પ્રસિધ્ય કરવી જોઈશે અને ત્યારપણી દર વર્ષે આ પ્રકાશનોને અધ્યતન કરવા જોઈએ : - હા

J. B. Dobriya
જાહેર માહિતી અધિકારી અને
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
નવસારી કૃષિ યુનિવર્સિટી
વધુરી, જિ.ડાંગ

ઓનેક્ષર-બી

(સામાન્ય વહીવટ વિભાગના તા.૦૧-૦૫-૨૦૦૮ ના પરિપત્ર ક્રમાંક: પીએડી-૧૦-૨૦૦૭-૩૩૫૩૬૪
આરટીઆઈ સેલનું બિડાણ)

પ્રમાણપત્ર

આથી પ્રમાણિત કરવામાં આવે છે કે, માહિતી અધિકાર અધિનિયમની કલમ-૪ અંતર્ગત સ્વયં જાહેર કરવાની બાબતો પ્રોએક્ટીવ ડીસ્કલોઝર (P.A.D.) મારા વિભાગ દ્વારા કરવામાં આવેલ છે.
તા.૦૧/૦૫/૨૦૨૨ ની સ્થિતિએ અમારી મંજુરી મેળવી અધતન કરવામાં આવેલ છે.

તા.૦૧/૦૫/૨૦૨૨

જાહેર માહિતી અધિકારી અને
વરિષ્ઠ વૈજ્ઞાનિક અને વડા
કૃષિ વિજ્ઞાન કેન્દ્ર
નવસારી કૃષિ યુનિવર્સિટી
વધઈ, જિ.ડાંગ

અપાલ સંતાયિકારી
અને
વિસ્તરણ શિક્ષણ નિયામકે
નવસારી કૃષિ યુનિવર્સિટી
નગરસાંજી